

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલીફોન નંબર ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૮/૦૪/૨૦૧૬ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૧૭/૧૬

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૦ કેસ કરી, ૧૦ વ્યક્તિઓને ઝડપી ૧૦ લીટર દેશી દારૂ કબજે કર્યો હતો.

તકેદારીના પગલાં હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૭૧૮/૧૬

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલાં હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૦૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી તેમજ પ્રોહી ૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિની અટકાયત કરી હતી.

અપહરણની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૭૧૯/૧૬

વસ્ત્રાપુર: ભાવનાબહેન રામાભાઈ ઉર્ફે રામજીભાઈ પરમાર (ઉ.વ.૧૫) (રહે. ધ ફસ્ટ નામની નવી બનતી સાઈટ ઉપર શિવાલિક હાઈટસની પાછળ, માનસી રોડ વસ્ત્રાપુર) ને તા.૧૫/૪/૧૬ બપોરના ૧૨/૦૦ થી ૧/૦૦ વાગ્યા દરમિયાન રહેણાંક નજીક રહેતો આરોપી મનીષકુમાર સદરજી ચૌધરી લગ્ન કરવાની લાલચ આપી લલયાવી ફોસલાવી જારકર્મ કરવાના ઇરાદે રહેણાંક નજીકથી ભગાડી લઈ ગયો છે. આ અંગેની ફરીયાદ ભાવનાબહેનના પિતા રામાભાઈ ઉર્ફે રામજીભાઈ પરમારે તા.૧૭/૪/૧૬ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.કે.રાઠોડ ચલાવે છે.

સોનાનો દોરો ખેચી તોડી લઈ ગયો:-

સમાચાર યાદી નં.૭૨૦/૧૬

પાલડી: કંચનબહેન મુકેશભાઈ મિસ્ત્રી (ઉ.વ.૫૨) (રહે. શક્તીનગર સોસાયટી કે.કે.નગર રોડ એચ.પી. પેટ્રોલ પંપની બાજુમાં ઘાટલોડીયા) તા.૧૭/૪/૧૬ બપોરના ૪/૧૫ વાગ્યાના સુમારે ધરણીધર તરફથી માણેકબાગ જતાં ઓવરબ્રિજના છેડા નજીકથી પત્ની સાથે એક્ટીવા પાછળ બેસી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાળા રંગની મોટર સાયકલ ઉપર આવેલ એક પુરુષ કંચનબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેચી તોડી લઈ નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ કંચનબહેન મિસ્ત્રીએ પાલડી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ ઇન્ચાર્જ પો.ઇ.શ્રી બી.પી.રાણા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૭૨૧/૧૬

રીવરફ્રંટ વેસ્ટ: વિજયભાઈ લક્ષ્મણભાઈ પરમાર (ઉ.વ.૩૬) (રહે. વડલાવાળી ચાલી નીલા કમલની બાજુમાં પોપટીવાડ રાજપુર ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૧૭/૪/૧૬ કલાક ૧૦/૦૦ વાગ્યા પહેલાં કોઈપણ સમયે આંબેડકરબ્રીજના પશ્ચીમ તરફ રીવરફ્રંટ સાબરમતી નદીમાં પડતુ મુકી આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી રીવરફ્રંટ વેસ્ટ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી ખોડાભાઈ અરજણભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.